

Prime Minister's Office

PM's remarks on the situation in India-China Border areas

Entry date: 17 JUN 2020 3:35PM by PIB Delhi

વડાપ્રધાનની કચેરી

ભારત-ચીન સીમા ક્ષેત્રોમાં પરિસ્થિતિ પર વડાપ્રધાનની ટિપ્પણીઓ

એન્ટ્રી તારીખ: 17 જૂન 2020 બપોરનાં 3:35 વાગ્યે પીઆઈબી દિલ્લી દ્વારા

સાથીઓ,

ભારત માતાનાં વીર પુત્રોએ ગલવાન વેલીમાં આપણી માતૃભૂમિની રક્ષા કરતી વખતે સર્વોચ્ચ બલીદાન આપ્યું છે.

દેશની સેવામાં કરવામાં આવેલા આ મહાન બલિદાન માટે હું તેઓને નમન કરું છું, હું કૃતજ્ઞતા સાથે તેઓને શ્રદ્ધાંજલી પાઠવું છું.

આ શોકનાં મુશ્કેલ સમયમાં, આપણા શહિદોનાં પરિવારોને હું સાંત્વના પાઠવું છું.

આજે સમગ્ર દેશ તમારી સાથે છે, દેશની લાગણીઓ તમારી સાથે છે.

આપણા શહિદોનું આ બલિદાન વ્યર્થ નહીં જાય.

પરિસ્થિતિ કોઈપણ હોય, સંજોગો કોઈપણ હોય, ભારત દેશનાં આત્મ-સન્માન અને જમીનનાં દરેક ઈંચની અડગતાપૂર્વક રક્ષા કરશે.

ભારત સાંસ્કૃતિક રીતે શાંતિપ્રિય દેશ છે. આપણો ઈતિહાસ શાંતિનો છે.

ભારતનો સૈદ્ધાંતિક મંત્ર આ રહ્યો છે -: સમસ્તાલ: સુખિનો ભવતુ

દરેક કાળમાં, આપણે સમગ્ર માનવજાત માટે શાંતિ અને સુખાકારીની શુભકામના રાખી છે.

આપણે હંમેશા આપણા પાડોશીઓ સાથે સહકાર અને મૈત્રીપૂર્ણ રીતે નજીકથી કામ કર્યું છે. હંમેશા તેઓનાં વિકાસ અને સુખાકારીની શુભેચ્છા રાખી છે.

જ્યાં પણ આપણા તફાવતો રહ્યા છે, ત્યાં આપણે તે તફાવતો તકરારો ન બને તેવો હંમેશા પ્રયાસ કર્યો છે, તફાવતો તકરારોમાં રૂપાંતરિત ન થાય તે અનિવાર્ય છે.

આપણે કદાપી કોઈને ઉશ્કેરતા નથી, પરંતુ આપણે આપણા દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ પણ કરતા નથી.

જ્યારે પણ સમય આવ્યો છે, ત્યારે આપણે આપણા સામર્થ્યનું નિરૂપણ કર્યું છે, દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા કરવામાં આપણી ક્ષમતાઓને સાબિત કરી છે.

ત્યાગ અને શિક્ષણ આપણા રાષ્ટ્રિય ચરિત્રનો હિસ્સો છે, પરંતુ તે જ સમયે, સામર્થ્ય અને વીરતા પણ આપણા દેશનાં ચરિત્રનો એકસમાન હિસ્સો છે.

હું દેશને ખાતરી આપવા માંગુ છું કે, આપણા સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જાય.

ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ આપણા માટે સર્વોચ્ચ છે, અને તેનું રક્ષણ કરવામાં આપણને કોઈ અટકાવી શકે નહીં.

આ બાબત અંગે કોઈને પણ કોઈપણ મુંઝવણ કે શંકા ન હોવી જોઈએ.

ભારત શાંતિ ઈચ્છે છે. પરંતુ ભારતની ઉશ્કેરણી કરવા પર, ઉચિત જવાબ પણ આપવામાં આવશે.

આપણા શહિદ સૈનિકોએ કરેલા બલિદાન બદલ દેશ ગર્વ અનુભવે છે. હું આપ સર્વેને બે મિનીટ શાંતિ રાખી અને આપણા વીર પુત્રોને શ્રદ્ધાંજલી આપવા પ્રાર્થના કરું છું.

VRRK/VJ

(રીલીઝ આઈડી: 1632065) વિઝિટર કાઉન્ટર: 175

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.